https://archive.org/details/bk1419/page/n0/mode/1up

2015-12 -Satpanth Prakash (1419)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

વર્ષ : ૪, અંક : ૧૦, સળંગ અંક : ૪૬, ડીસેમ્બર - ૨૦૧૫
દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

Full Library on https://realpatidar.com/library

સત્પંથ પ્રકાશ

પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પ.પૂ. શ્રી ભાયલાલકાકા (આઠીયા સંસ્થા ટ્રસ્ટ-પ્રેરણાપીઠ, પીરાણા)
બંને સંતોનું નૂતન વર્ષ નિમિત્તે ભાવમિલન (તા. ૧૧-૧૧-૨૦૧૫)

છૂટક કિંમત રૂા. ૯/-, વા.લ. રૂા.૧૦૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1419/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 7.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1419/page/n2/mode/1up

2015-12 -Satpanth Prakash (1419)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:01:24 +05'30'

realpatidar.com

વર્ષ : ૪, અંક : ૧૦, સળંગ અંક : ૪૬, ડીસેમ્બર - ૨૦૧૫

દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

સત્પંથ પ્રકાશ

Bhailal Kaka of Aathiya Satpanth Samaj with Nanakdas Kaka

પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પ.પૂ. શ્રી ભાયલાલકાકા (આઠીયા સંસ્થા ટ્રસ્ટ-પ્રેરણાપીઠ, પીરાણા) બંને સંતોનું નૂતન વર્ષ નિમિત્તે ભાવમિલન (તા. ૧૧-૧૧-૨૦૧૫)

છૂટક કિંમત રૂ. ૯/-, વા.લ. રૂ.૧૦૦/-

realpatidar.com

realpatidar.com

સંવત્ ૨૦૭૨ના નૂતનવર્ષના અભિનંદન પ્રસંગે સંતમિલન સુયોગ અવસર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૧-૧૧-૨૦૧૫)

ઉપરોક્ત પ્રસંગે આઠીયા ટ્રસ્ટના કાકાશ્રી ભાયલાલકાકા
પૂ. જગદ્ગુરુશ્રીનું ચરણ-પૂજન કરી કરી રહ્યા છે.

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજ
પૂ. ભાઈલાલકાકાનું ચંદન-તિલક-ફૂલહારથી સન્માન કરે છે.

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્ગુરુશ્રીનું આરતી દ્વારા
પૂજન કરતા આઠીયા ટ્રસ્ટના પૂ. શ્રી ભાયલાલકાકાશ્રી
તેમજ ભાવિક અનુયાયી ભક્તો

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજ
તથા પૂ. શ્રી ભાયલાલકાકાશ્રી
ભાવિક ભક્ત અનુયાયીઓ સાથે

ઉપરોક્ત પ્રસંગે સદ્ગુરુશ્રી ઈમામશાહ મહારાજના
સમાધિ સ્થાનકે પૂજન કરતા પૂ. જગદ્ગુરુશ્રી
તથા પૂ. ભાઈલાલકાકાશ્રી

ઉપરોક્ત પ્રસંગે
પૂ. જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજ
તથા પૂ. શ્રી ભાયલાલકાકાશ્રી

realpatidar.com

https://archive.org/details/bk1419/page/n4/mode/1up

realpatidar.com

વાર્ષિક પાટોત્સવ એવં સરસ્વતી સન્માન સમારોહ-નૂતનવર્ષ સ્નેહમિલન

શ્રી નિષ્કલંકીધામ-નખત્રાણા (તા. ૧૮-૧૧-૨૦૧૫)

ઉપરોક્ત પ્રસંગે સંતો-મહંતોના સામૈયાં

ઉપરોક્ત-પ્રસંગે સભામાં દીપ પ્રાગટ્ય કરી રહેલ
પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન સંતો-મહંતો મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના
વરદ્‌હસ્તે "પેવર બ્લોક રોડ"નું ઉદ્‌ઘાટન સંતોના સાનિધ્યમાં

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજના
વરદ્‌હસ્તે "પંખીઘર"નું ઉદ્‌ઘાટન સંતોના સાનિધ્યમાં

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજના
વરદ્‌હસ્તે "ફ્લોરીંગ કંપાઉન્ડ"નું ઉદ્‌ઘાટન સંતોના સાનિધ્યમાં

ઉપરોક્ત પ્રસંગે સભામંડપમાં ભાવિક હરિભક્તો

realpatidar.com

https://archive.org/details/bk1419/page/n5/mode/1up

realpatidar.com

વાર્ષિક પાટોત્સવ એવં સરસ્વતી સન્માન સમારોહ-નૂતનવર્ષ સ્નેહમિલન

શ્રી નિષ્કલંકીધામ-નખત્રાણા (તા. ૧૮-૧૧-૨૦૧૫)

ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા
જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજ

ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા
પૂ. મહંતશ્રી જયરામદાસજી મહારાજ

ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા
પૂ. મહંતશ્રી સીવગણદાસજી મહારાજ

ઉપરોક્ત પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા
શ્રી પૂજાભાઈ રામજીયાણી, શ્રી ધનજી મુખી, શ્રી જેઠાભાઈ સેંઘાણી, શ્રી અરજણબાપા

સરસ્વતી સન્માન પ્રસંગે મંચસ્થ બિરાજ સંતો-મહાનુભાવો તથા સરસ્વતી સન્માન
પ્રસંગે વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને કુલીંગ વોટરજગથી સન્માન કરતા પૂ. જગદ્ગુરુશ્રી

સરસ્વતી સન્માન પ્રસંગે પ્રમાણપત્ર અને કુલીંગ વોટરજગથી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનું સન્માન કરતા
પૂ. મહંતશ્રી જયરામદાસજી મહારાજ, પૂ. મહંતશ્રી સીવગણદાસજી મહારાજ, પૂ. સંતશ્રી રતિબાપા, પૂ. શ્રી મૂળજીબાપા

realpatidar.com

https://archive.org/details/bk1419/page/n6/mode/1up

realpatidar.com

સહકાર ભારતીનું પાંચમું રાષ્ટ્રીય અધિવેશન

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૨૦-૧૧-૨૦૧૫ થી તા. ૨૨-૧૧-૨૦૧૫)

પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા મા. શ્રી બજરંગદાસ ગુપ્તા-અર્થ શાસ્ત્રી (આર.એસ.એસ.-અ.ભા. રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય) વૈચારિક ગોષ્ઠી કરી રહ્યા છે.

પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ (આર્ષ વિદ્યા મંદિર - રાજકોટ) ભાવમિલન

સહકાર ભારતીના પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન કરતા પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ

પૂ. જગદ્‌ગુરુશ્રીનું મોમેન્ટો દ્વારા સન્માન કરતા સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા

પૂ. જગદ્‌ગુરુશ્રી તથા મા. કેન્દ્રીય કૃષિ અને સહકારમંત્રી શ્રી રાધામોહન સિંહ સાથે વૈચારિક ગોષ્ઠિ

પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ, મા. કેન્દ્રીય કૃષિ અને સહકાર મંત્રીશ્રી રાધામોહનજી, મા. શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા (રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી - સહકાર ભારતી), મા. શ્રી બજરંગદાસ ગુપ્તા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1419/page/n7/mode/1up

2015-12 -Satpanth Prakash (1419)

realpatidar.com

સત્પંથ પ્રકાશ

વર્ષ : ૪, અંક : ૧૦, સળંગ અંક : ૪૬, ડીસેમ્બર - ૨૦૧૫

:: સ્થાપકશ્રી ::
શ્રી શામજીભાઈ કે. પટેલ - વડાગામ

:: સંપાદકશ્રી ::
શ્રી શાંતિભાઈ ડી. પટેલ - મુંબઈ

:: સહ સંપાદકશ્રી ::
શ્રી બાબુભાઈ એસ. પટેલ - અમદાવાદ

:: સત્પંથ પ્રકાશન સમિતિ ::

:: પ્રમુખશ્રી ::
શ્રી મનોજભાઈ એન. પટેલ - વડોદરા

:: મંત્રીશ્રી ::
શ્રી જશુભાઈ કે. પટેલ - વિઠ્ઠલપુરા લાટ

:: સહ મંત્રીશ્રી ::
શ્રી સુરેશભાઈ એમ. પટેલ - અમદાવાદ

:: સદસ્યશ્રીઓ ::
શ્રી પ્રિ. સુરેશભાઈ એસ. પટેલ - ખેડબ્રહ્મા
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી - માંડવી
શ્રી નારણભાઈ ડી. પટેલ - પૂના
શ્રી અંબાલાલ પી. પટેલ - રામાપીરકંપા
શ્રી અમૃતલાલ જે. રૂડાણી - નાના અંગીયા
શ્રી હર્ષદકુમાર જે. પટેલ - પીરાણા લાટ

:: સલાહકારશ્રીઓ ::
શ્રી શામજીભાઈ એલ. ધોળુ - વડોદરા
શ્રી કરશનભાઈ વી. પટેલ - ધનસુરા

:: સત્પંથ પ્રકાશ - લવાજમ દર ::

		ભારતમાં		વિદેશમાં
વાર્ષિક	:	૧૦૦=૦૦	:	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	:	૨૫૦=૦૦	:	૧૮૦૦=૦૦
આજીવન	:	૮૫૦=૦૦	:	૪૦૦૦=૦૦
અમર	:	૧૫૦૦=૦૦	:	૭૦૦૦=૦૦

:: પ્રકાશક ::

સત્પંથ પ્રકાશન સમિતિ,
પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫.

E-mail : satpanthprakash@gmail.com
(Contact : Mob. No. 9909508029)

Website : www.nishklankinarayan.com

કુરીયર્સ : મારૂતિ કુરીયર્સ, બારેજા - અમદાવાદ.
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.
સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુક સ્ટોલ
મો. ૯૪૨૭૩૭૧૯૪૦ ફોન : ૦૨૭૧૮-૨૮૮૮૧૨

ડીઝાઈન અને ટાઈપ સેટીંગ : કપીલ ચૌહાન (મો.) ૯૩૭૭૧૭૮૫૮૫

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ : બી-૫/૬/૭, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ટોરેન્ટો પાવરની બાજુમાં, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોન : (૦૭૯) ૨૫૬૩૦૩૭૨/૭૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૩, અંક : ૨, સળંગ અંક : ૨૯૯

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

સંસારમાં સર્વ શ્રેષ્ઠ દાન જ્ઞાન દાન છે કારણ કે ચોર તેને ચોરી શક્તો નથી, કોઈ તેનો નાશ કરી શકતું નથી તે સતત વધતું રહે છે અને લાખો લોકોને સુખ આપે છે.

વિદ્વાનોનું એ કર્તવ્ય છે કે અજ્ઞાનના અંધકારમાં ભટકતા સમાજને જ્ઞાનના પ્રકાશથી સાચો માર્ગ બતાવે. કોઈને ધન-દોલત, કપડાં-લત્તાં, ખાવા-પીવાનું આપવું એ બરાબર છે પણ તેનો પ્રભાવ ક્ષણિક હોય છે. જ્ઞાનનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે. તેનાથી માનવીને સાચો માર્ગ મળે છે. આ એક સ્થાયી સંપત્તિ છે. જેનો લાભ માનવી જીવનપર્યંત મેળવે છે અને સાથે સાથે સંપત્તિમાં ગુણાત્મક વૃદ્ધિ થતી જાય છે. જ્ઞાનનો સદુપયોગ કરવાની વિવેકબુદ્ધિ કેટલાક વિરલ પુરુષોમાં જ હોય છે. મોટા ભાગના લોકો ના સમજ છે અને જે થોડા ઘણા સમજદાર છે તેમાંથી પણ મોટાભાગના ચિંતન અને ચારિત્ર્યની ભ્રષ્ટતાથી, આળસ અને પ્રમાદથી, કુવિચારોના દુરાગ્રહથી ખરાબ રીતે ફસાયેલા છે.

જ્ઞાનથી માનવીની સમજદારી વધે છે. જ્યારે સમજાદારી વધશે ત્યારે તેની અંદર ઈમાનદારી વધશે. ઈમાનદારી વધશે તો માનવીમાં જવાબદારી આવશે અને જવાબદારી વધશે તો બહાદુરી આવશે. ચારે વસ્તુઓ એક બીજા સાથે જોડાયેલી છે. માનવીમાં એવી શક્તિ ઉત્પન્ન થશે કે તે અનીતિ સામે બાથ ભીડે, દુષ્પ્રવૃત્તિઓ, કુરીતિઓ, કુસંસ્કારો અને કુવિચારનો સમૂળગો નાશ કરવા માટે જીવન આપવા સુધી તૈયાર થાય અને એક સ્વસ્થ ઉન્નત સમાજના નિર્માણમાં આગળ પડતી ભૂમિકા નિભાવી શકે.

જે બીજાઓને વિદ્વાન, સુશીલ અને સદાચારી બનાવવા માટે જ્ઞાનદાન કરે છે તે જ સારો બ્રહ્મનિષ્ઠ પુરુષ છે.

સંપાદક : શ્રી શાંતિભાઈ ડી. પટેલ

• • •

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1419/page/n8/mode/1up

realpatidar.com

Satpanth Religious Literature - Shrimad Bhagwat Dashavatar Written by Imamshah

શાહ મહારાજ રચિત

વત્ દશાવતાર"

ંહ અવતાર)

(ગતાંકથી ચાલુ)

હિરણ્યકશ્યપે કંટાળીને એક છેલ્લો પ્રયોગ આચરવાનું વિચાર્યું. એણે તેના સેવકોને લાકડાનો પર્વત જેવો ઢગલો કરવાનું કહ્યું. અસુરોએ એ મોટી ચિતા પ્રહલાદને બાળી નાખવા માટે કરી. લોકોને જ્યારે ખબર પડી કે પ્રહલાદને બાળવા માટે આ ચિતા બનાવી છે, ત્યારે કોમળ અંતઃકરણના નગરજનોને પ્રહલાદ માટે અનુકંપા જાગી, હૃદય દ્રવીત થયાં પણ બોલવાની કોઈનામાં હિંમત નહોતી, કારણ કે હિરણ્યકશ્યપના ક્રોધમાં નાહક બળીશું એટલે અંતઃકરણથી જ તેઓ પ્રહલાદનું રક્ષણ કરવા માટે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા. રાજાની આજ્ઞા પ્રમાણે નક્કી કરેલ સમયે પ્રત્યેક નગરજનોએ પોતાના ત્યાંથી ઈંધણ લઈને ત્યાં હાજર રહેવું. પ્રહલાદની મા ક્યાધુને પણ પોતાના બાળકની આ કઠોર શિક્ષા નજરોનજર જોવાની હતી. પણ આ વખતે વિશેષ ધૈર્ય રાખી એણે એક ચિત્તથી અગ્નિદેવને મનોમન પ્રાર્થના કરી કે : 'હે અગ્નિ નારાયણ ! કુંભારના ધગધગતા ઢગલામાંથી તે જે પ્રમાણે બિલાડીના બચ્ચાં સુરક્ષિત રાખ્યાં એ પ્રમાણે મારા બાળકનું પણ તું રક્ષણ કરજે ! મારા બાળકની આ અનામત તને સુપ્રત કરી છે. હે પ્રભુ ! માતાનું અંતઃકરણ તું જાણે જ છે ! પણ રાજસત્તા આગળ મારું કંઈ બળ ચાલી શકતું નથી, માટે તું આ બાળકને સંભાળ !' આ રીતે પ્રાર્થના કરીને એણે હોળીની પૂજા કરી. તેટલામાં બ્રાહ્મણ વેષ ધારણ કરીને અગ્નિ નારાયણે ક્યાધુને દર્શન આપીને આશ્વાસન આપ્યું : 'બાળા, તું ચિંતા ન કરીશ. આમ આશ્વાસન આપી બ્રાહ્મણ દેવતા અદૃશ્ય થઈ ગયા. અહીં હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે, પોતાની બહેન જે હોલીકા છે એને કહ્યું કેઃ તને તપ સામર્થ્યથી અગ્નિ નિવારક જે વસ્ત્ર મળેલ છે એ પહેરીને સર્વ અંગ એનાથી ઢાંકીને આ આપણા શત્રુ પ્રહલાદને ખોળામાં બરાબર પકડી રાખ એટલે કે ક્યાંય ભાગી ન જતાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. હોલીકા પ્રહલાદને ખોળામાં બેસાડી લઈ એ પ્રચંડ ઢગલા પર બેઠી અને અગ્નિ લગાડવામાં આવ્યો. ધીમે ધીમે અગ્નિ જ્વાળા ગગનમાં પહોંચી. દેવ યોગે વાયુના વેગથી હોળીકાનું અગ્નિ નિવારક વસ્ત્ર ક્યાંય ઊડી ગયું એ કોઈએ જોયું નહીં. મોટેથી બૂમો પાડતી હોળીકા એ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. પ્રહલાદે માત્ર એ પ્રચંડ અગ્નિમાં નિશ્ચળ શાંત ચિત્તથી બેસીને પોતાની ધીર ગંભીર વાણીથી પિતાને કહ્યું : 'પિતાજી, તમે ભગવાનનો દ્વેષ કરવાનું છોડી દો. નારાયણના નામનો આ પ્રભાવ તો જુઓ કે આ અગ્નિ પણ મને અત્યંત શીતલ લાગે છે. તમે સર્વસત્તાધીશ એવા શ્રી હરિનારાયણનું સ્મરણ કરી સાંસારિક તાપથી નિર્ભયપણે મુક્ત થાઓ.'

પુત્રનું ધૈર્ય અને એની એવી નિર્ભય, નિશ્ચલ, શાંત એવી સ્થિતિ જોઈને દૈત્યરાજ હિરણ્યકશ્યપ ભયથી વિહ્વળ થયો. એ વિચાર કરવા લાગ્યો. આ નાનકડો બાળક 'મારા મૃત્યુનું કારણ તો નહીં હોય ને' ! ક્ષણભર એ પૂર્વવત્ પોતાની ભૂમિકા પર આવ્યો, ગુરુપુત્રોએ કહ્યા પ્રમાણે શિક્ષણ અને સંગના પ્રભાવથી પુત્ર સુધરી જશે એમ એની ઈચ્છા હતી. ગુરુગૃહે ગુરુએ શિખવેલી વિદ્યા એ ગ્રહણ કરતો હતો. પણ એનું ચિત્ત એમાં રહેતું નહોતું. જ્યારે બંને ગુરુ આશ્રમના કામકાજમાં લાગતા ત્યારે પ્રહલાદ પોતાના બધા સહપાઠી વિદ્યાર્થી મિત્રોને બોલાવી લેતો હતો. એક તો એ રાજકુમાર અને પોતે અત્યંત નમ્ર અને બધા પર પ્રેમ કરનાર હતો એટલે બોલવતાં જ બધા છોકરાઓ પોતાની રમત વગેરે છોડીને એની પાસે એકત્ર થઈ બેસી જતા. પ્રહલાદ અત્યંત પ્રેમથી એ બાળકોને સમજાવીને કહેતો કે; 'બંધુઓ, આપણો આ મનુષ્ય જન્મ વ્યર્થ નષ્ટ કરવો યોગ્ય નથી. જો આ મનુષ્ય દેહે ભગવાનની પ્રાપ્તિ નહીં થાય તો આપણને ખૂબ મોટું નુકશાન થશે એમ સમજજો. ઘરબાર, સ્ત્રીપુત્ર, રાજ્યધન વગેરે તો દુઃખ જ આપે છે. એમાં મોહ કરવાથી નરક ગતિ પ્રાપ્ત થાય છે. ઈંદ્રિયોને વિષયથી અલગ કરવી એ ખરું સુખશાંતિનું મૂળ છે. ભગવાન પ્રાપ્તિનું સાધન તો મુખ્યતઃ આ બાલ્યવસ્થામાં જ સાધ્ય કરવું પડે. મોટા થયા પછી તો સ્ત્રી પુત્ર વગેરેના

realpatidar.com

https://archive.org/details/bk1419/page/n9/mode/1up

realpatidar.com

મોહમાં મન બદ્ધ થઈ જશે અને વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરવાની કેટલીય ઈચ્છા થશે તો પણ કંઈ કરી શકાશે નહીં. ભગવદ્ પ્રાપ્તિ માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે એવું નથી. એ તો આપણા બધાના હૃદયમાં રહે છે. બધા પ્રાણીમાત્રમાં એ જ એક ભગવાન છે માટે કોઈપણ પ્રાણીને દુઃખી કરી કષ્ટિ ન આપવી. મનને હંમેશાં ભગવાનમાં લગાવવું જોઈએ.'

સાદા સરળ હૃદયે દૈત્ય બાળકોના મન પર પ્રહલાદના આ ઉપદેશનો પ્રભાવ પડતો હતો. વારંવાર સાંભળ્યા પછી આ ઉપદેશાનુસાર વર્તવા એ પ્રયત્ન કરવા લાગ્યા. શુક્રાચાર્યજન પુત્રો ષણ્ય-અમર્કએ આ બધું જોયા પછી એમને ખૂબ જ બીક લાગવા લાગી. એમણે પ્રહલાદને દૈત્યરાજ હિરણ્યકશ્યપ પાસે લઈ જઈને બધી વાતોનું નિવેદન કર્યું. મનમાં સારા એવા ઉપાય શોધી જોયા પણ એકે ઉપાય સૂઝતો નહોતો. કારણકે પ્રહલાદને મારવા એક પણ ઉપાય એણે બાકી રાખ્યો નહોતો. છેલ્લે એને એક યુક્તિ સુઝી.

દૈત્યરાજ હિરણ્યકશ્યપના મનમાં કાળની સંરચના થઈ. 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ'. પ્રહલાદ આ મારો જ પુત્ર હોવાથી મારી આજ્ઞા પાળતો નથી. માટે બધા નગરજનો સામે અને મારા બધા મંત્રીગણ સમક્ષ હું એને જાહેર રીતિથી પ્રાણાન્તની શિક્ષા કરીશ. અગ્નિથી તપાવેલ ધગધગતા લોહસ્તંભથી વ્રજપ્રાય એવા લોખંડી સાંકળદંડથી પ્રહલાદને બાંધી એને દેહાન્તની શિક્ષા કરવામાં આવશે એમ એણે જાહેર કર્યું. બધા નગરજનોને એ શિક્ષા વખતે હાજર રહેવા કહ્યું. આદેશ પ્રમાણે આખું નગર વધ સ્થળે હાજર થઈ ગયું. કોઈ ઉત્સુક્તાથી, કોઈ રડતાં રડતાં, તો કોઈ નિરાશવદને હાજર રહ્યાં. લોહસ્તંભમાંથી અગ્નિજ્વાળા નીકળતાં સુધી સ્તંભને તપાવવામાં આવ્યો અને પછી બાળક પ્રહલાદને યમદૂત જેવા એ ક્રૂર સૈનિકોએ એ વધ સ્થળે હાજર કર્યો. અત્યંત નમ્ર અને નિશ્ચળ ભાવથી અને નિર્ભયતાથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બાળક પ્રહલાદ ત્યાં હિરણ્યકશ્યપ સામે ઊભો રહ્યો. પિતાને એણે અભિવાદન કર્યું. બધા નગરજનો જોઈ રહ્યા. પ્રહલાદ વિષયે બધાંના મનમાં પ્રેમભાવ અને આદર ભાવ જાગૃત થયો પણ હિરણ્યકશ્યપની કઠોર નજરથી રાજસત્તા સામે બોલવાની કોઈનામાં હિમત નહોતી. માતા ક્યાધુને પણ એ જગ્યાએ ઉપસ્થિત રહેવા સંદેશ મોકલ્યો. રાજજ્ઞાનુસાર એને પણ પોતાની નજર સામે પોતાના પ્રિય પુત્રની હત્યા જોવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું.

એટલામાં દૈત્યરાજ હિરણ્યકશ્યપએ પ્રહલાદને આક્રોશભર્યા અવાજે ગર્જના કરતાં કહ્યું: 'અરે દુષ્ટ, કુલઘાતક, જયાં ત્યાંથી છૂટી જઈ પ્રાણ રક્ષા કરે છે ? હવે આ જો ધગધગતા લોહસ્તંભ અને એનાથી તને આ વ્રજપ્રાય સાંકળદંડથી બાંધીને તારી કેવી દશા કરું છું. નિશ્ચિત સમજ કે અહીંથી તું હવે ક્યાંય ભાગી જઈ શકીશ નહીં અને એ કોણ નારાયણ, તારો સહાયક ક્યાં બેઠો છે ? અને એ હવે તારું કઈ રીતે રક્ષણ કરે છે એ હું જોઈ લઈશ.' એમ કહી પ્રહલાદને સ્તંભથી બાંધવાની આજ્ઞા કરી. ત્યારે નિર્ભયતાથી અને નમ્રતાથી પ્રહલાદ શ્રી નરસિહ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. હિરણ્યકશ્યપએ ક્રોધાવેશમાં કહ્યું: હે દુષ્ટ પુત્ર પ્રહલાદ, આ ધગધગતા અગ્નિમય લોહ સ્તંભમાં પણ તારો ભગવાન છે ? પ્રહલાદે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે; પિતાજી, સર્વ વ્યાપક શ્રી હરિ આ લોહ સ્તંભમાં પણ છે. હિરણ્યકશ્યપએ પ્રહલાદનાં આ વાક્યો પણ પૂરાં થવા દીધાં નહીં. એણે ક્રોધાતિશયથી સિંહાસન પરથી કૂદકો મારી પૂર્ણપણે શક્તિ ભેગી કરી જોરથી એ લોહસ્તંભને લાત મારી અને એ સાથે મહાભયંકર અવાજ થઈને આખું બ્રહ્માંડ જ ફાટ્યું હોય એમ દિવ્ય નાદ સાથે ભયંકર ગર્જનાનો એ જગ્યાએ નિનાદ થયો. બધા લોકો ભયભીત થયા. હિરણ્યકશ્યપ પણ સ્તંભીત થઈ આમ તેમ જોવા લાગ્યો. એણે જોયું કે એ સ્તંભ વચ્ચોવચ્ચથી ફાટી ગયો, અને એમાંથી મનુષ્યના શરીર અને સિંહના મુખ જેવી એક અદ્ભૂત દિવ્ય તેજસ્વી આકૃતિ સાથે એક વિકરાળ એવું નરસિંહ સ્વરૂપ ધારણ કરીને શ્રીહરિ પ્રગટ થયા.

અત્યંત તેજસ્વી સહસ્ત્ર સૂર્ય એકત્રિત થયા હોય એવું નરસિંહ સ્વરૂપ હતું. એના દાંત જાણે પૂર્ણિમાના ચંદ્ર છે કે શું એમ ભાસતા હતા અને પૂંછડી તો જાણે હજાર ફેણ ધારણ કરનાર વાસુકી નાગની છે કે શું તેવી લાગતી હતી અને જીભ તો જાણે વિદ્યુતથી જળહળે છે એમ લાગતી હતી.

(વધુ આવતા અંકે)

•••

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

વિશ્વશાંતિ અને પર્યાવરણ બચાવ નિમિત્તે
૨૭૫ કુંડી વિષ્ણુ મહાયજ્ઞ પ્રસંગે
પૂ. અનંત વિભૂષિત શ્રીમદ્
જગદ્‌ગુરુ રામાનંદાચાર્ય
સ્વામી હંસાદેવાચાર્યજી મહારાજ
(જગન્નાથધામ-હરિદ્વાર) તથા
પૂ. મહામંડલેશ્વર સ્વામી જનાર્દનહરિજી
મહારાજ (ફૈજપૂર-મહારાષ્ટ્ર)
ધ્રબુડી, તા. માંડવી-કચ્છ (તા. ૨૧-૧૧-૧૫)

વિશ્વશાંતિ અને પર્યાવરણ
બચાવ નિમિત્તે
૨૭૫ કુંડી વિષ્ણુ
મહાયજ્ઞ પ્રસંગે
ભારતભરમાંથી પધારેલ
જગદ્‌ગુરુશ્રીઓ,
મહામંડલેશ્વરશ્રીઓ,
મહંતો-સંતો વગેરે.
ધ્રબુડી, તા. માંડવી-કચ્છ
(તા. ૨૧-૧૧-૧૫)

પ.પૂ. સંતશ્રી તુલસીબાપા જન્મદિન
ઉજવણી પ્રસંગે આસન પર
બિરાજમાન
પૂ. સંતશ્રી તુલસીબાપા,
સીકાકંપા, તા. ધનસુરા.
(તા. ૧૫-૧૦-૨૦૧૫)

પ.પૂ. સંતશ્રી તુલસીબાપા જન્મદિન
ઉજવણી પ્રસંગે સભામાં બિરાજમાન
શિષ્યમંડળ તથા
ભાવિક હરિભક્તો
સીકાકંપા, તા. ધનસુરા.
(તા. ૧૫-૧૦-૨૦૧૫)

realpatidar.com

https://archive.org/details/bk1419/page/n11/mode/1up

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18-05-2012.
Registered Under Postal Registration No. GAMC - 1830/2015-2017 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2017. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક

Brijesh Patel
+91 99742 64444

Tarun Patel
+91 90991 16999

Feel your Dreams...

Satyam Auto
Consultant

All Type of Car Sales & Parches

1-A, Jayvijay Society, Opp. Paliyadnagar Garden,
Nr. Devendra Bus Stop, Naranpura, Ahmedabad.

સુવિચાર

- સત્સંગમાંથી માનવને સાધના પ્રાપ્ત થાય છે. ભલે તે શાંતિના રૂપમાં હોય કે મુક્તિના રૂપમાં, સેવાના રૂપમાં હોય કે પ્રેમના રૂપમાં હોય કે ત્યાગના રૂપમાં હોય.
- કોઈપણ અવસ્થામાં મનને વ્યથિત ન થવા દો. આત્મા પર વિશ્વાસ કરીને આત્મનિષ્ઠ બની જાઓ, નિર્ભયતા તમારી દાસી બનીને રહેશે.

રવાના :

સત્પંથ પ્રકાશ
સત્પંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To, ____________________

Printed, and Published by **SHANTIBHAI D. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset,** B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Prernapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHANTIBHAI D. PATEL**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com